

ચંદ બદ-ખસલતો અને ખરાબ આદતો એવી છે કે, જેના સબબ અલ્લાહ તેના બંદાથી રિઝક અને બરકત દૂર કરે છે :

- (૧) નમાઝ, અલ્લાહની બંદગી અને ઈબાદતથી ગાફિલ થાવું.
- (૨) નમાઝને કસ્ટન-જાણી જોઈને મૂકી દેવી.
- (૩) ઉસ્તાઝ અને મોઅલ્લિમની તૌહીન, બેઈઝઝતી કરવી, હલકી નિગાહથી જોવું.
- (૪) વાલેદૈનની નાફરમાની કરવી, ઈઝા આપવી.
- (૫) મૈયત નઝદીક મરનારની ગીબત કરવી, મઝાક-મસ્ખરી કરવી, કબ્રોને દરમિયાન જમવું.
- (૬) ઊભા ઊભા પૈશાબ કરવી.
- (૭) અનાજ અને દીગર ખાવાની ચીઝોને ઝાયેઅ કરવી, ઝમીન પર ફેંકવી.
- (૮) પરાયા બૈરો સાથે જિસ્માની તઅલ્લુકાત રાખવા, ઝિના કરવી, બદકારી કરવી.
- (૯) અલ્લાહની રાહમાં પોતાની દૌલતમાંથી હુકૂક અદા ન કરવા, જેમ કે ઝકાત, સદકા, બૈરાતને અદા કરવામાં ગફલત કરવી.
- (૧૦) મહેમાન અને પડોશીના હક્કને નઝરઅંદાઝ કરવા.
- (૧૧) જૂદ, શબ્બોસિતમ, બદકલામી, બકવાસ, ગુસ્સો અને ગાલી-ગલોચ કરવી.
- (૧૨) હાથ-મોં ને પોતાને પહેરેલા કપડાથી સાફ કરવા.
- (૧૩) માંકડીના જાલાને અને ધૂલ-કચરાને ઘરમાં રહેવા દેવા.
- (૧૪) ઘરની દેહલીઝ-દરવાઝા પર બેસી હાથ-મોં ધોવા અને ગંદુ પાની વેરવું.
- (૧૫) જમી રહ્યા બાદ ગંદા વાસણોને ઘરમાં રાખી મુકવા.
- (૧૬) ઔલાદની તરબીયત-તાઅલીમમાં કુસૂર અને ગફલત કરવી.
- (૧૭) ફજરમાં સુરજ ઉગવા તક બિસ્તરમાં પડી રહેવું.
- (૧૮) જૂદા કસમ ખાવા.
- (૧૯) વુસ્ટુ ને દરમિયાન વાત કરવી.
- (૨૦) બૈતુલ ખલા (સંડાસ) માં બોલવું.
- (૨૧) લસણ-પ્યાજના છૂલતાઓ બાલી નાખવા.
- (૨૨) નમાઝ બાદ મસ્જિદથી જલ્દી બાહર નીકલી જાવું. દુઆ અને તસ્બીહ ન કરવી.
- (૨૩) મસ્જિદમાં દુનિયાની વાતો કરવી, નમાઝમાં ખલલ પાડવો, ઝોરથી બોલવું, ગીબત કરવી.
- (૨૪) કોઈ પણ તરહના અનાજના આટાથી હાથને સાફ કરવા.
- (૨૫) તકીયો દઈને જમવું, ટેકી દઈને યા સુઈને જમવું.
- (૨૬) માં-બાપને તેમના નામથી પુકારવા.
- (૨૭) બદન પર જ ફાટેલા કપડાને ટાંકા લગાવવા યા પૈવન્દકારી કરવી.
- (૨૮) ફકીર-મોહતાજથી ખાવાની ચીઝને ખરીદવું.
- (૨૯) ફૂંક મારીને ચિરાગ-દીવાને બુઝાવવો.
- (૩૦) રાતમાં બાઝાર અને મોહલ્લામાં બગૈર કોઈ સબબ ભટકવું.
- (૩૧) કલમ-પેનને પગના નીચે રાખવું.
- (૩૨) તૂટેલા કાંસકાથી બાલને સંવારવા.
- (૩૩) તૂટેલા વાસણથી પાની પીવું યા વાસણના નાલકાથી પાની પીવું.
- (૩૪) તૂટેલી કલમથી લખવું.
- (૩૫) નખને દાંતથી કતરવા.
- (૩૬) ઝઈફ શખ્સને આગલ-આગલ ચાલવું.
- (૩૭) રાતમાં આઈનામાં જોવું.
- (૩૮) દિન અને રાતમાં હદથી ઝિયાદહ સુવું યા બદનને વધારે રાહત આપવી.
- (૩૯) દાંતોમાં ખેલાલ કરા કરવું, કોતરા કરવું.
- (૪૦) હદથી ઝિયાદહ ખર્ચ કરવું, ઈસ્રાફી કરવી.
- (૪૧) શરીઅતને ખિલાફ કોઈ પણ કામમાં પૈસા ખર્ચ કરવા.
- (૪૨) ઊભા રહીને માથાના બાલને ઓઢવા.
- (૪૩) ચોરી, દગાબાઝી, મક્કારી યા બીજાના માલને હડપ કરી કોઈના દિલને દુખાવવું.
- (૪૪) જમન યા તરકારીને સુંઘવું.
- (૪૫) સબબ બગૈર ભીખ માંગવાની અને મદદ તલબ કરવાની આદત રાખવી.
- (૪૬) નાયવાની-ગાવાની મહેફિલોમાં જાવું.
- (૪૭) રિશ્તેદારોથી તઅલ્લુકાત તોડી નાખવા.
- (૪૮) સલામ-ઈકરામ કરવાને મૂકી દેવું.
- (૪૯) રાતના વક્ત સાઈલ-ફકીરને રદ કરવું, હાજિતરવાઈ ન કરવી.
- (૫૦) જે ચીઝોથી નશો ચઢે તેની આદત રાખવી, જુગાર રમવો, શરત લગાવવી.
- (૫૧) દુનિયાની ઝૈબો ઝીનત વાસ્તે દૌલતની લાલચમાં હરામખોરીનો રસ્તો અપનાવવો. ★